



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

79

115 મહાનગર સેવા સદન, અમદાવાદ
(સ્કીમ અમલ વિભાગ)

ઝોન : પૂર્વ/સીડી

Ref :- Description of Land : ઇલેક્શન વોર્ડ નં. તથા નામ : ૪૨ (વલ્લભાઈ)

T.P.S. No. ૧૦૪ (અમીર)	F.P.No. ૫૦ (સુલતાનપુરા)	S.P./Tena/Block No. -
Rev.Village અમીર	R.S. No. -	Block No. -
Gamtal -	C.S. No. ૫૫	Sheet No. -

FOR OFFICE USE ONLY

સ્કીમ અમલ અંગેનો અભિપ્રાય


તા. ૦૪-૧૦-૨૦૧૮

(૧) પ્લોટની વિગત :

રેવન્યુ સર્વે નંબર	ઓ.પી.નંબર	ફા.પ્લોટ નંબર	ક્ષેત્રફળ
-	-	૫૦	૨૩૪૨૫ ચો.મી. (૨૨૬૯૮ ચો.મી.)

(૨)	સ્કીમ રૂએ કપાત જમીનનો કબજો મળેલ છે કે કેમ? હા કે ના જો હા તો	હા
	(અ) ફા.પ્લોટના માપ મળી રહે છે કે કેમ? હા કે ના જો ના તો તેની વિગત	ના, પ્લોટની દરિયાઈ ગા.ટી.આ. સ્કીમનું ૧૦૫ (વલ્લભાઈ) કાનૂનકે દે. થી. બાઉન્ડરી માં અંતરેય થવાથી ૭૨૭.૦ ચો.મી. વધુ થઈ છે.
	(બ) ટી.પી.રસ્તાના માપ મળે રહે છે કે કેમ? હા કે ના જો ના તો તેની વિગત	હા
(૩)	કોર્ટ લીટીગેશન થયેલ છે કે કેમ? હા કે ના જો, હા તો તેની વિગત	-

(૪) રિમાર્ક્સ : કબજો ના દરિયાઈ થી.આ. સ્કીમનું ૧૦૫ ની બાઉન્ડરી અંતરેય થવાથી ૭૨૭.૦ ચો.મી. વધુ થઈ છે. જે કોર્ટ દ્વારા નક્કર ના બાઉન્ડરી.



તા. ૦૪/૧૦/૨૦૧૮

સર્વેક્ષક

ટાઉન ડેવલપમેન્ટ ઇન્સ્પેક્ટર


PART PLAN OF FINAL T.P. SCHEME NO:104 (ODHAV)

Sanctioned Under Urban Development and Urban Housing Department, Government of Gujarat
Notification NO:- GH/V/224 OF 2017/TPS-112016-3938 - L, Dt:29-07-2017

FINAL PLOT NO: 50



SCALE: 1c.m.=40 Mts.



This part plan is certified for the F.P NO: 50

Note:- This part plan cannot be used for making any entry in revenue records and can not be considered As Development Permission or Permission for Addition/Alteration.

નોંધ:- આ ફક્ત ટી.પી. સ્કીમ મુજબનો પાર્ટ-પ્લાન છે. રોડલાઈનની અસર/ઝોનિંગ વિગેરે બાબતો અંગે સીડીપી મુજબનાં પાર્ટ-પ્લાન/અભિપ્રાય મુજબ વર્તવાનું રહેશે.

અરજદાર દ્વારા ઇ.નં. 20190209/434 તા. 01/2/19 થી નકલની માંગણી કરેલ હોઈ પહોંચ નં. તા. રૂા. વસુલ લઈ નકલ આપવામાં આવેલ છે.

Prep. By

[Signature]
CDD

Chd. By:

[Signature]
08/02/2019

for H. D' man:

LEGEND

- F.P BOUNDARY
- ROAD
- T.P.S. BOUNDARY

FOR OFFICE USE ONLY

TRUE COPY

[Signature]
11/2/2019

TOWN PLANNING INSPECTOR
TOWN DEVELOPMENT DEPARTMENT
AHMEDABAD MUNICIPAL CORPORATION
AHMEDABAD

PART PLAN SHOWING
F.P. NO.:- 50
T.P.S. NO. & NAME :- 104_ODHAV
DISTRICT:- AHMEDABAD




1 c.m. = 40 mt.

LEGEND

- Residential Zone I-R1
- Village Boundary
- TPS Boundary
- Existing Road
- Proposed Road

Part plan as per Second Revised Development Plan_2021
Prepared by AUDA and Final sanctioned U/s-17(1)(C) of
the G.T.P. & U.D. Act-1976 (Presidents act no.27 of 1976.)
by the Urban Development & Urban Housing Department-
Govt. of Gujarat vide its Notification No.GH/V/207
of 2014/DVP-112013-4777-L Dtd.20-12-2014.



This part plan is certified for the F.P. NO. :- 50

FOR OFFICE USE ONLY

NOTE :- (1) This part plan cannot be used for making any entry in revenue records and can not be considered as any Development Permission.

(2) This Part-Plan is as per RDP-2021. Please refer T.P.Scheme Part-Plan for details of TP Road & Boundary of Final Plot etc.

Application Inward No.:- BP 2019.0207/434
Amount Received Rs./-.....
Receipt No.T..... Dtd.1...../2019.

TRUE COPY

[Signature]
11/2/2019

[Signature]
Prep. By: CJD

Chd. By:

[Signature]
+ 08/02/2019
H. D' man:

TOWN PLANNING INSPECTOR
TOWN DEVELOPMENT DEPARTMENT
AHMEDABAD MUNICIPAL CORPORATION
AHMEDABAD.



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
નગર વિકાસ ખાતુ, મધ્યસ્થ કચેરી,
મહાનગર સેવા સદન, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ-૩૮૦૦૦૧. ગુજરાત.
Website:- www.ahmedabadcity.gov.in

અરજી ક્રમાંક :- I/20190208/434

અરજી તા.:-

પહોંચ નં.:-

અરજદારશ્રી :- FOR OFFICE USE ONLY

ઝોનિંગ સર્ટિફિકેટ

ગુજરાત નગર રચના યોજના અને શહેરી વિકાસ અધિનિયમ- ૧૯૭૬ની કલમ- ૧૭(૧)(ક) હેઠળની જોગવાઈઓ અન્વયે રાજ્ય સરકારશ્રીનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગનાં જાહેરનામા ક્રમાંક GH/V/207 OF 2014/ DVP-112013-4777-L, તા.:-૨૦/૧૨/૨૦૧૪થી અમલમાં આવેલ ઔડા દ્વારા તૈયાર થયેલ દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના- ૨૦૨૧ મુજબનાં નકશાનાં આધારે.

ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. :- ૧૦૪ - ઓઢવ (પ્રિલિમિનરી)

ફાયનલ પ્લોટ નં. :- ૫૦

રી.ડી.પી. શીટ નં. :- ૧૦૭

ની જમીન રહેણાંક ઝોન-૧ (એક) R1 માં આવે છે.

નોંધ:

૧. આ ફક્ત ઝોનિંગ સર્ટિફિકેટ છે, બાંધકામની પરવાનગી નથી.
૨. રીડીપી ૨૦૨૧ મુજબ સદરહુ ફા.પ્લોટ નો હેતુ "SEWSH" નો છે, તથા ટી.પી. સ્કીમ રૂઘચે સદરહુ ફા.પ્લોટનોહેતુ "SEWSH" દર્શાવેલ છે.

FOR OFFICE USE ONLY
ખરી નકલ

તારીખ:- ૧૨/૧૨/૨૦૧૯.

જુ. ફાફ્ટસમેન + હેડ ફાફ્ટસમેન
08/02/2019

ટાઉન પ્લાનિંગ ઇન્સ્પેક્ટર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ.



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

નગર વિકાસ ખાતુ, - ડ્રોઈંગ બ્રાંચ

વિકાસ નિયંત્રણ અભિપ્રાય

OFFICE USE ONLY

CASE NO.

220190202/434

ZONE

Ref :- Description of Land :

Date

--	--	--	--	--	--	--	--

T.P.S. No. & Name

704 ડાકેય (સાચી)

F. P. No.

50					
----	--	--	--	--	--

S. P. No.

--	--	--	--	--	--

Tena. No.

--	--	--	--	--	--

Block No.

--	--	--	--	--	--

Rev. Village

ડાકેય

R. S. No.

373378/5, 372

Block No.

--	--	--	--	--	--

C. S. No.

--	--	--	--	--	--

Gamtal

--	--	--	--	--	--

Sheet No.

--	--	--	--	--	--

Engineer / Architech Name
& Seal & Sign

Election Ward No.

FOR OFFICE USE ONLY

(I) પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ અંગેનો અભિપ્રાય

નકશા પરથી સ્કેલ રીડીંગ કરતાં રેકર્ડમાં જણાવેલ પ્લોટ પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટથી અંદાજે 100 મીટરની અંદર/અંદાજે 100 મીટરની અંદર/અંદાજે 300 મીટરની બહાર આવે છે.

તારીખ 28/12/2019

Jr. Drafts man

Head Drafts man

(II) OPINION OF BUILDING HEIGHT RESTRICTION

(As per reference letter No. AAI/AH/ATCO-22 (NOC)/3497-502,
dtd.28/02/2003 & plan approved by airport Authority of India)

Note: The maximum permissible height above ground level (AGL) of the building/structure as mentioned below, is the topmost height of the building / structural member, which includes any kind of fixed or overhanging elements, (e.g. water tank, parapet, lift machine room, stair cabin, antenna, light arresters, etc.)

1. The above mentioned site falls within the Airport critical area / NDB restricted area. , therefore " NO PERMISSION " for construction can be given "UNLESS THE N.O.C. of AIRPORT AUTHORITY" will be obtained and submitted by the applicant.
2. The above mentioned site falls within "specified area/funnel area" , commencement certificate can be issued upto the maximum permissible height of 30 mts. Above ground level (AGL), subject to the condition that the "N.O.C. of Airport Authority" will be obtained by the applicant before applying for the Building Use permission.
3. By scaling on map which are approved by Airport Authority the above mentioned site is located at a approximate distance of about 06.50 km, from "A.S.R. (Radar)" commencement certificate can be issued upto the maximum permissible height of 30 mts. above ground level (AGL), subject to the condition that the "N.O.C. of airport Authority" must be obtained and submitted by the applicant before applying for the Building Use permission.
4. By scaling on map which are approved by Airport Authority, the above mentioned site falls within "Funnel Area" located at the distance of about 06.50 km. from the basic strip of "05 end of runway", commencement certificate can be issued upto the maximum permissible height of 30 mt. above the ground level (AGL), subject to the condition the "N.O.C. of Airport Authority" will be obtained and submitted by the applicant before applying for the building use permission.

Date 28-2-2019

Jr. Draftman

Head Drafts man

Ref :- Description of Land : 202-107 OFFICE USE ONLY

T.P.S. No. & Name 104 22/09 (2011)

F.P.No. 50

S.P. No.

Tena.N

Block No.

Rev. Village 241209

R.S. No.

BStock No

Gamtal.

Sheet No.

C.S. No.

૧. વપરાશ ઝોન: ૨૬૬૨૭ પ્લોટ નંબર ૧૭૨ S.E.W. ૪ તરફ નોંધેલ છે.
૨. ટા. પ્લા. સ્કીમ રૂબે/૭ માઈટી.સી. લે-આઉટ મુજબ રેકરન્સમાં જણાવેલ પ્લોટની પૂર્વ દિશાએ _____ મીટરનો, પશ્ચિમ દિશાએ ૨૫૦૦ મીટરનો, ઉત્તર દિશાએ ૨૫૦૦ _____ મીટરનો તથા દક્ષિણ દિશાએ _____ મીટરનો ટી.પી./પ્લાનમાં ચામ/લાઈવે રોડ પસાર થાય છે, તે મુજબ દરેક માપી પ્લોનમાં દર્શાવવા, સ્થળે નકશા મુજબના માપો ચેક કરી, રોડની જગ્યા પુલ્લી છોડાવી, આગળની જરૂરી કાર્યવાહી કરવી તથા નિયમ અનુસાર રોડ ગોળાર્દ દર્શાવતી તેમજ લાચુ નંબરો તથા નોર્થ લાઈન દર્શાવવી.
૩. રેકરન્સમાં જણાવેલ પ્લોટનો રી.ડી.પી. રોડ લાઈનની નીચે મુજબની અસર _____ છે/થતી નથી.
૪. પૂર્વ દિશાએ આવેલ _____ મીટરનો ટી.પી.રોડ મંજૂર થયેલ રીવાઈઝડ વિકાસ નકશા મુજબ _____ મીટરનો થાય છે.
૫. પશ્ચિમ દિશાએ આવેલ _____ મીટરનો ટી.પી.રોડ મંજૂર થયેલ રીવાઈઝડ વિકાસ નકશા મુજબ _____ મીટરનો થાય છે.
૬. ઉત્તર દિશાએ આવેલ _____ મીટરનો ટી.પી.રોડ મંજૂર થયેલ રીવાઈઝડ વિકાસ નકશા મુજબ _____ મીટરનો થાય છે.
૭. દક્ષિણ દિશાએ આવેલ _____ મીટરનો ટી.પી.રોડ મંજૂર થયેલ રીવાઈઝડ વિકાસ નકશા મુજબ _____ મીટરનો થાય છે.
૮. જેના લીધે સદરહુ પ્લોટની પૂર્વ/પશ્ચિમ/ઉત્તર/દક્ષિણ બાજુએ રોડની સમાંતર _____ મીટરની કપાત થાય છે, જે લેઆઉટ પ્લાનમાં માપ સાથે દર્શાવી સ્થળે પુલ્લી છોડાવવી તથા તે સંદર્ભે પ્લોટની સ્થિતિ તથા તેના ક્ષેત્રફળને થતી અસર લે-આઉટ પ્લાનમાં તથા એરીયા ટેબલમાં દર્શાવી અને તે સબબ આનુષંગિક નિયમોની થતી અસર ચકાસી પ્રવર્તનમાન નિયમો અનુસાર આગળની જરૂરી કાર્યવાહી કરવી.
૯. રેકરન્સમાં જણાવેલ પ્લોટની _____ દિશાએ રેલ્વે લાઈન આવેલ છે.
૧૦. રેકરન્સમાં જણાવેલ પ્લોટ ગાંધીઆશ્રમ કોમ્પ્રેસીવ એરીયા ઈમ્યુવમેન્ટ યોજના વિસ્તારમાં આવેલ છે.
૧૧. રેકરન્સમાં જણાવેલ પ્લોટ સાબરમતી રીવર ફ્રન્ટ કંટ્રોલ એરીયામાં આવેલ છે.
૧૨. રેકરન્સમાં જણાવેલ પ્લોટ સાબરમતી રીવર ફ્રન્ટ ડેવલપમેન્ટ વિસ્તારમાં આવેલ છે.
૧૩. મેટ્રો રેલ રૂટની અસર _____ છે / થતી નથી.
૧૪. સદરહુ નંબર S.P. રીંગરોડની અંદર આવે છે / બહાર આવે છે.
૧૫. કબ્જ ફેરફાર અંગે આનુષંગિક કાર્યવાહી કરવાની રહેશે. તથા સ્કીમ અનુસાર વિસ્તારમાં સ્કીમ અનુસાર મુજબ કાર્યવાહી રહેશે.
૧૬. સેન ટી.પી. વિસ્તાર/ફ્રન્ટ સીમમાં ટી.ડી.પી. કપાત અંગેની આનુષંગિક કાર્યવાહી કરવાની રહેશે.

④ યો.શ્ર. સ્ત્રી ૩ માં સંદર્ભ સોરના લેણુ DEFEND તરીકેની ગુ.ભેપરિશન નો આયોજીતના સોર લેણુ-એસ્ટેટ ખાતાની અભિપ્રાય બેખાળ સંજ્ઞાસર આ બુક્કો ગિત મર્યાવાણુ તથા બી રહેણી.

७) नक्षत्र-स्त्रीमन्त्रादि विनाशका अग्निप्रायश्चित्तपराका विनाश किये जाते। अग्निप्रायश्चित्त, स्त्रीमन्त्रादि अग्निप्रायश्चित्त विनाशका। विशेष नैवेद्यता त एवमेव निरुद्ध विवेकात् आनुशान्तिन मर्यादात् नृवाजी २४३०

૧. પ્રવર્તન નીતિનિયમો, અભિપ્રાય, પરિપત્રો તથા તે સબજન આનુષંગિક બાબતો તેમજ પ્રવર્તમાન સામાન્ય વિકાસ નિયંત્રણ વિનિયમો (જી.ડી.સી.આર.) ની જોગવાઈ ચકાસી આગળની આનુષંગિક કાર્યવાહી કરવા વિનંતિ.
૨. સરકારમાં સાદર કરેલ ડ્રાફ્ટ ટાઉન પ્લાનીંગ સ્કીમ વિસ્તારમાં સમાવિષ્ટ થતા પ્લોટ માટે પ્રથમ ટાઉન પ્લાનીંગ ઓફીસરશ્રીનો અભિપ્રાય મેળવ્યા બાદ મધ્યસ્થ કચેરી સીટી પ્લાનીંગ ખાતાનો અભિપ્રાય મેળવી તેઓના અભિપ્રાય મુજબની આગળ કાર્યવાહી કરવા વિનંતિ.
૩. ટાઉન પ્લાનીંગ સ્કીમ બનેલ ન હોય તેવા વિસ્તાર માટે મધ્યસ્થ કચેરી સીટી પ્લાનીંગ ખાતાનો અભિપ્રાય મેળવી તેઓના અભિપ્રાયવાળા લે-આઉટ પ્લાનમાં દર્શાવા મુજબના માપ, ક્ષેત્રફળ તથા લોકેશન અનુસારની સ્થળ પરના માપની ચકાસણી કરી જમીન ખુલ્લી છોડાવવા જરૂરી કાર્યવાહી કરવી અને ફાઈલ લે-આઉટ પ્લાનની એક નકલ મધ્યસ્થ કચેરી સીટી પ્લાનીંગ ખાતામાં તથા બીજી નકલ ડ્રોઈંગ શાખામાં મોકલવા વિનંતિ.
૪. ગામતળમાં સમાવિષ્ટ તથા વિસ્તારમાં એસ્ટેટ ખાતાના અભિપ્રાય મુજબ આગળની કાર્યવાહી કરવી તથા સપ્લાઈની વિગતો ચકાસી સપ્લાઈ મુજબ લાગુ સીટી સર્વે નં. તથા એસ્ટેટ તથા ટી.ડી.ઓ. ડ્રોઈંગ ખાતાના અભિપ્રાય મુજબની વિગતો દર્શાવી ચકાસવા વિનંતિ.
૫. ભાગલા/એકત્રીકરણના કેસમાં ૨ (બે) ટ્રેસીંગની નકલ રજૂ કરાવવી તથા મંજૂરી આપવામાં આવેથી ૧ (એક) નકલ ટી.ડી.ઓ., ડ્રોઈંગ બ્રાંચને મોકલી આપવા વિનંતિ.
૬. સ્કીમ અમલ તથા બેટરમેન્ટ ચાર્જ અંગે સંલગ્ન ખાતાનો અભિપ્રાય મેળવવા આનુષંગિક કાર્યવાહી કરવાની રહેશે.

જુની.ડ્રાફ્ટસમેન

७३३ प्रोफेसरसभेन

ટાઉન પ્લાનીંગ ઈન્સ્પેક્ટર

ગુજરાત નગર રચના અને નિરીક્ષણ કાયદા-૧૯૭૬

પ્રકાર "એ"

પ્રકાર ૨૧ અને ૩૫

નગર રચના યોજના નં. ૧૦૪ (ઓડ) (અંતિમ યોજના)

પ્રતિ વર્ષવાર અને પ્રિન્ટિંગ આદરણીય પદ

૦૩૨. ૨૪૦૦ ગાંધી

સરનામું	પ્રકાર	પ્રથમ વર્ષ				બીજા વર્ષ				કુલ	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર
		પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર										
૧	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	૧૧	૧૨	૧૩	૧૪	૧૫	૧૬	૧૭	૧૮	૧૯	૨૦
૨	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	૨૧	૨૨	૨૩	૨૪	૨૫	૨૬	૨૭	૨૮	૨૯	૩૦
૩	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	૩૧	૩૨	૩૩	૩૪	૩૫	૩૬	૩૭	૩૮	૩૯	૪૦
૪	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	૪૧	૪૨	૪૩	૪૪	૪૫	૪૬	૪૭	૪૮	૪૯	૫૦
૫	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	૫૧	૫૨	૫૩	૫૪	૫૫	૫૬	૫૭	૫૮	૫૯	૬૦
૬	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	૬૧	૬૨	૬૩	૬૪	૬૫	૬૬	૬૭	૬૮	૬૯	૭૦
૭	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	૭૧	૭૨	૭૩	૭૪	૭૫	૭૬	૭૭	૭૮	૭૯	૮૦
૮	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	૮૧	૮૨	૮૩	૮૪	૮૫	૮૬	૮૭	૮૮	૮૯	૯૦
૯	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	૯૧	૯૨	૯૩	૯૪	૯૫	૯૬	૯૭	૯૮	૯૯	૧૦૦
૧૦	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	૧૦૧	૧૦૨	૧૦૩	૧૦૪	૧૦૫	૧૦૬	૧૦૭	૧૦૮	૧૦૯	૧૧૦
૧૧	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	૧૧૧	૧૧૨	૧૧૩	૧૧૪	૧૧૫	૧૧૬	૧૧૭	૧૧૮	૧૧૯	૧૨૦
૧૨	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	૧૨૧	૧૨૨	૧૨૩	૧૨૪	૧૨૫	૧૨૬	૧૨૭	૧૨૮	૧૨૯	૧૩૦
૧૩	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	પ્રકાર	૧૩૧	૧૩૨	૧૩૩	૧૩૪	૧૩૫	૧૩૬	૧૩૭	૧૩૮	૧૩૯	૧૪૦

૦૪/૦૫/૧૭
૦૩/૦૫/૧૭
૦૩/૦૫/૧૭

૦૩/૦૫/૧૭
૦૩/૦૫/૧૭
૦૩/૦૫/૧૭

TRUE COPY
Town Planning Inspector
Ahmedabad Municipal Corporation
Ahmedabad.

OFFICE USE ONLY